



## જલ્દી કૃપિ હવામાન એકમ (DAMU)

ગ્રામીણ કૃપિ મૌસમ સેવા (GKMS)

કૃપિ વિજ્ઞાન કેન્દ્ર

જુ.કુ.યુ., જામનગર- ૩૬૧૦૦૬

તા.૦૭-૧૧-૨૦૨૦ થી તા.૧૧-૧૧-૨૦૨૦



જામનગર જલ્દી કૃપિ હવામાન બુલેટીન નં.૪૬(૨૦૨૦) તારીખ: ૦૬-૧૧-૨૦૨૦

(જૂનાગઢ કૃપિ યુનિવર્સિટી અને ભારત મૌસમ વિભાગ દ્વારા સંપત્તિ)

પાછળા અઠવાડીયાનું જામનગર નું હવામાન

| હવામાનપરિબળો            |          |           |
|-------------------------|----------|-----------|
| વરસાદ (મી.મી)           |          | ૦.૦       |
| મહત્તમ તાપમાન (સે.ગ્રે) |          | ૩૩.૦-૩૪.૦ |
| લધુતમ તાપમાન (સે.ગ્રે)  |          | ૧૬.૫-૧૮.૦ |
| ભેજ(%)                  | સવાર     | ૬૨-૭૭     |
|                         | બપોર બાદ | ૨૪-૩૩     |
| પવનની ગતિ (કિમી/કલાક)   |          | ૨.૫-૩.૭   |

### હવામાન આગાહી

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિભાગ - જામનગર જલ્દીની હવામાન આગાહી

તા.: ૦૭-૧૧-૨૦૨૦ થી તા. ૧૧-૧૧-૨૦૨૦

| તારીખ<br>પેરામીટર      | દિવસ-૧   | દિવસ-૨   | દિવસ-૩   | દિવસ-૪   | દિવસ-૫   |
|------------------------|----------|----------|----------|----------|----------|
|                        | ૦૭-૧૧-૨૦ | ૦૮-૧૧-૨૦ | ૦૯-૧૧-૨૦ | ૧૦-૧૧-૨૦ | ૧૧-૧૧-૨૦ |
| વરસાદ (મી.મી.)         | ૦        | ૦        | ૦        | ૦        | ૦        |
| મહત્તમ તાપમાન(સે.ગ્રે) | ૩૩       | ૩૪       | ૩૫       | ૩૫       | ૩૫       |
| લધુતમ તાપમાન(સે.ગ્રે)  | ૨૩       | ૨૩       | ૨૩       | ૨૩       | ૨૩       |
| વાદળની સ્થિતિ          | ચોખ્ખું  | ચોખ્ખું  | ચોખ્ખું  | ચોખ્ખું  | ચોખ્ખું  |
| મહત્તમ ભેજ (%) સવાર    | ૩૫       | ૪૭       | ૫૬       | ૪૩       | ૩૫       |
| લધુતમ ભેજ (%) બપોર બાદ | ૨૨       | ૨૧       | ૨૬       | ૨૮       | ૨૧       |
| પવનની ગતિ (કિમી/કલાક)  | ૧૧       | ૧૨       | ૧૪       | ૧૫       | ૧૩       |
| પવનની દિશા (ડિગ્રી)    | પૂર્વ    | દક્ષિણ   | વાયવ્ય   | ઈશાન     | પૂર્વ    |

નોંધ: આ આગાહી સમગ્ર જલ્દીની સરેરાશ હોય છે એટબે તેને કોઈ પણ એક જગ્યા માટે લાગુ કરવી નહીં.

ભારત સરકારશીના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ગ્રામીણ કૃપિ મૌસમ સેવા વિભાગ, કૃપિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર તરફથી જાણાવવામાં આવે છે કે ઉત્તર સૌરાષ્ટ્ર ખેત અબોહવાકીય વિસ્તારના જામનગર જલ્દીમાં

આગામી સપ્તાહદરમ્યાન આકાશ ચોખ્ખું રહેશે. આગામી સપ્તાહમાં વરસાઈ પડવાની સંભાવના નહીંવન છે. આ સમય ગાળામાં મહત્વમાન તાપમાન દિવસ દરમ્યાન ૩૪-૩૫ ડિગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૩ ડિગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. સવારના સમયે બેજનું પ્રમાણ ૩૫-૪૫ % રહેશે તથા બપોર પદ્ધીના બેજનું પ્રમાણ ૨૧-૨૮ રહેવાની શક્યતા છે. પવનની દિશા મોટેભાગે ઈશાન- દક્ષિણ રહેવાની અને પવનની ઝડપ ૧૧-૧૫ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

### પાક પ્રમાણે કૃષિ સલાહ

| મુખ્યપાક | રોગ/જીવાત/જાત | કૃષિસલાહ                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       |
|----------|---------------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| ધાઉ      | વાવેતર        | <ul style="list-style-type: none"> <li>ધાઉના વાવેતર માટે જમીન તૈયાર કરવી.</li> <li>ટ્રપ સિંચાય ની સગવડ હોય તો તેના દ્વારા જ પિયત આપવું જોઈએ.</li> <li>સારી ગુણવત્તા વાળા બીજ વાવેતર માટે એકઠા કરી લેવા જોઈએ.</li> <li>વાવેતર સમયને અનુરૂપ જતો પસંદ કરવી જેવીકી <ul style="list-style-type: none"> <li>વહેલી વાવણી (૧૦ નવેમ્બર પહેલા): શ.જે. ઉભલ્યુ-૪૬૩</li> <li>સમયસર વાવણી (૧૫ થી ૨૫ નવેમ્બર: લોક-૧, શ. ઉભલ્યુ-૩૬૬, ૪૫૧, ૪૮૬</li> <li>મોડી વાવણી: (૨૬ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર): શ.ઉભલ્યુ-૧૭૩, ૧૧, લોક-૧૧</li> </ul> </li> <li>ધાઉના પાકમાં N-P-K ની જરૂરિયાત ૧૨૦:૬૦:૦૦ કિગ્રા/હેક્ટર છે, જેથી પાયાના ખાતર તરીકે ૧૩૦ કિગ્રા ડિઓપી અને ૮૦ કિગ્રા યુરિયા પ્રતિ હેક્ટરે આપવું.</li> <li>બીજ દર : ૧૦૦-૧૨૫ કિગ્રા/ હેક્ટર</li> </ul> |
| ચાળા     | વાવેતર        | <ul style="list-style-type: none"> <li>ચાળાના વાવેતર માટે જમીન તૈયાર કરવી.</li> <li>ઓક્ટોબર મહિનાના અંતમાં બિન પિયત જતોનું વાવેતર કરવું અને પિયત જતોનું નવેમ્બર મહિનામા વાવેતર કરવું.</li> <li>વાવેતર માટે ગુજરાત ચાળા -૩ અને ગુજરાત ચાળા -૫ જેવી વધુ ઉત્પાદન આપતી જતો પસંદ કરવી.</li> <li>વાવેતર સમયે પાયામાં રસાયણીક ખાતર ૮૫ કીગ્રા ડિઓપી અને ૧૦ કીગ્રા યુરિયા પ્રતિ હેક્ટરે આપવું.</li> <li>બીજ દર : ૬૦-૭૫ કિગ્રા/ હેક્ટર</li> </ul>                                                                                                                                                                                                                                                                                        |
| જરૂર     | વાવેતર        | <ul style="list-style-type: none"> <li>જરૂરના વાવેતર માટે જમીન તૈયાર કરવી.</li> <li>નવેમ્બર મહિનામાં હંડીની શરૂઆત થયે વાવેતર કરવું.</li> <li>વાવેતર માટે ગુજરાત જરૂર-૩ અને ગુજરાત જરૂર-૪ નામની જતોનું વાવેતર કરવું.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 |
| ધાણા     | વાવેતર        | <ul style="list-style-type: none"> <li>ધાણા ના વાવેતર માટે જમીન તૈયાર કરવી.</li> <li>નવેમ્બર મહિનામાં હંડીની શરૂઆત થયે વાવેતર કરવું.</li> <li>વાવેતર માટે અને ગુજરાત ધાણા-૧, ગુજરાત ધાણા-૨જેવી ભલામણ કરેલ જતોનું વાવેતર કરવું.</li> <li>બીજ દર : ૧૫-૨૦ કિગ્રા/ હેક્ટર</li> <li>વાવેતર સમયે પાયામાં રસાયણીક ખાતર ૬૫ કીગ્રા એસ.એસ.પી અને ૪૫ કીગ્રા યુરિયા પ્રતિ હેક્ટરે આપવું.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                        |

|                                     |            |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    |
|-------------------------------------|------------|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| લસણ                                 | વાવેતર     | <ul style="list-style-type: none"> <li>• લસણ ના વાવેતર માટે જમીન તૈયાર કરવી.</li> <li>• નવેમ્બર મહિનામાં હંડીની શરૂઆત થયે વાવેતર કરવું.</li> <li>• વાવેતર માટે ગુજરાત લસણ-૩, ગુજરાત લસણ-૪, ગુજરાત જૂનાગઢ લસણ-પભલામણ કરેલ જાતોનું વાવેતર કરવું.</li> <li>• બીજ દર: ૬૦૦-૭૦૦ કિગ્રા (કળીયુ) /હેક્ટર</li> <li>• લસણના પાકમાં N-P-K ની જરૂરિયાત ૫૦:૫૦:૫૦ કિગ્રા/હેક્ટર છે, જેમાંથી પાયાના ખાતર તરીકે ૧૧૦ કિગ્રા ડીએપી, ૮૫ કિગ્રા યુરીયા, ૮૫ કિગ્રા મ્યુનિટ ઓફ પોટાશ અને ૨૫૦ કિગ્રા એરંડીનો ખોળ પ્રતી હેક્ટર મુજબ વાવણી સમયે આપવો.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            |
| ઠુંગળી                              | વાવેતર     | <ul style="list-style-type: none"> <li>• શિયાળુ ઠુંગળીના વાવેતર માટે નાસિક-૫૩, ભીમા સપુર, ભીમા રેડ, જુનાગઢ લોકલ, ગ. ઠુંગળી - ૧૧, પસા રેડ જેવી જાતો પસંદ કરવી.</li> <li>• બીજ દર: ૭-૮ કિગ્રા/ હેક્ટર</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |
| કપાસ                                | ગુલાબી ઈયળ | <ul style="list-style-type: none"> <li>• કપાસના પાકને ૭-૮ દિવસના અંતરે જરૂરિયાત મુજબ પિયત આપવું.</li> <li>• કપાસના પાકમાં વધારે ફૂલ અને ચાપવા બેસે તે માટે ૫ ફૂટે ઉપરની ટોચ કાપી નાખવી.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 |
| શ્રીપદ,<br>લીલા<br>તડકીયા,<br>કથીરી |            |   <ul style="list-style-type: none"> <li>• કપાસના પાકમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ઈન્ડોક્ઝાર્કર્ચ ૧૪.૫% એસ.સી. ૮ મિલી/પંપ અથવા કલોરીન્ટ્રાનીલીપ્રોલ ૨૦ એસ.સી. ૬ મિલી/પંપ અથવા ફ્લુબેન્ડીયમાઈડ ૩૮.૩૫% એસ.સી. ૨૦-૨૫ ગતમ/પંપ અથવા સ્પીનોસાડ ૪૫% એસ.સી. ૬ મિલી/ પંપ દવાનો ફૂલ અવસ્થાએ છંટકાવ કરવો જોઈએ.</li> <li>• કપાસના પાકમાં શ્રીપદ અને લીલા તડકીયાના નિયંત્રણ માટેપ.૦ મીલી ફોસ્ફામીડોન અથવા ૨૦ મીલી ડાયમીથોએટઅથવા ૨૦ મીલી મીથાઇલ-ઓ-ડેમેટોન દવા ૧૦ લીટરપાણીમાં બેળવી છંટકાવ કરવો.</li> <li>• ગરમીનું પ્રમાણ વધવાને કારણે કપાસના પાકમાં શ્રીપદ અને કથીરીના ઉપદ્રવનું પ્રમાણ પણ વધશે, જેથી તેના નિયંત્રણ માટે ગ્રોપરગાઈટ ૫૭% ઈ.સી. ૩૦ મિલી/પંપ અથવા એબામેક્ટીન ૧.૬% ઈ.સી. ૧૫ મિલી/પંપ જેવી દવાનો છંટકાવ કરવો.</li> <li>• કપાસના પાન પીળા અને લાલ થતા અટકાવવા માટે ૧૮-૧૯-૧૮ ખાતર ૧૦૦ ગ્રામ અને માઈક્રોમિક્સ (ગ્રેડ-૪) ૨૫ ગ્રામ પંપ માં નાખીને ૨-૩ છંટકાવ કરવા જોઈએ.</li> </ul> |
| મગફળી                               | પરિપક્વ    | <ul style="list-style-type: none"> <li>• પરિપક્વ અવસ્થાએ મગફળી ઉપાડવાની કામગીરી કરવી.</li> <li>• સંગ્રહ કરવા માટે મગફળીને ખુલ્લા તડકામાં સુકવીને તેમાં ૮-૧૦ ટકા જેટલું ભેજનું પ્રમાણ રહે તે પછી જ તેનો સંગ્રહ કરવો.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |
| દીવેલા                              | સુકારો     | <ul style="list-style-type: none"> <li>• દીવેલામાં સુકારાના નિયંત્રણ માટે કાર્બોન્ડાઝીમ ૫૦ વેપા ૨૦ ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લીટર ના પંપમાં ટ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                |

|              |                         |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          |                                                                                                                                                                                                                                                                              |
|--------------|-------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
|              | ઘોડિયા ઈયળ,<br>લીલી ઈયળ | <ul style="list-style-type: none"> <li>• ઘોડિયા ઈયળ અથવા લીલી ઈયળ ના નિયંત્રણ માટે ડાયકલોરોવોસ ૭૬ ઈસી ૧૦ મિલી અથવા મિથાઈલ ઓ-ઉમેટોન ૨૫ ઈસી ૧૫ મિલી ૧૫ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો.</li> <li>• જરૂરિયાત મુજબ પિયત આપવું.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    |                                                                                                                                                                                            |
| તુવેર        | સ્ટરીલીટી મોઝેક         | <ul style="list-style-type: none"> <li>• તુવેરમાં સ્ટરીલીટી મોઝેક (વંધ્યત્વનો રોગ, કથીરી) ના નિયંત્રણ માટે પ્રોપરાઈટ ૫૭% ઈ.સી ૩૦-૪૦ મિલી/પંપ છંટકાવ કરવો.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |                                                                                                                                                                                            |
| મફાઈ/જુવાર   | સાંધાનીમાંખી            | <ul style="list-style-type: none"> <li>• જુવારના પાકમાં સાંધાનીમાખીનો ઉપદ્રવ ના થાયતે માટે સતત નિરિક્ષણ કરતા રહેવું,<br/>જો ઉપદ્રવ વધુ હોય તો ઈમીડાકલોપ્રીડ૧૭.૮૮ ટકા એસ.એલ. પ.મિ.લી./૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  |                                                                                                                                                                                            |
| શાકભાજી પાકો |                         | <ul style="list-style-type: none"> <li>• રોગીષ છોડને ખેતરમાંથી ઉપાડીને જમીનમાં દાઢી દેવા જોઈએ.</li> <li>• શાકભાજી પાકોને નિંદાશુક્ત રાખવા જોઈએ.</li> <li>• વેલાવાળા શાકભાજી પાકમાં પાન કોરીયાનો ઉપદ્રવ ટાળવા માટે ૧૫ મિલી મિથાઈલ-ઓ-ઉમેટોન (૨૫ ઈસી) અથવા ૧૫ મિલી ડાયમીથોએટ (૩૦ ઈસી) ૧૫ લીટર પાણીના પંપમાં નાખીને છંટકાવ કરવો.</li> <li>• શ્રીપ્સ અને સંક્રદ માખીના નિયંત્રણ માટે એસીટામીપ્રીડ૨૦% ૧૦ ગ્રામ દવા ૧૫ લીટર પાણીના પંપમાં નાખીને દર ૧૫ દિવસે છંટકાવ કરવો.</li> <li>• મરચીના પાકમાં શ્રીપ્સ ના નિયંત્રણ માટે ૩૦ મિલી પ્રોફેનોફોસ ૧૫ લીટર પાણીમાં મિશ્રણ કરી છાંટવી. શ્રીપ્સ નો વધુ ઉપદ્રવ હોય તો સ્પીનોસાડ અથવા સ્પીનેટોર મદવા ૭-૮ મિલી. પ્રતિપંપ છાંટવી.</li> <li>• ટામેટોના પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળે છે તેના નીયંત્રણ માટે ઈન્ડોક્જાકાર્બ ૨૫ ઈસી ૩૦ મિલી અથવા સ્પીનોસાડ ૪૫ ઈસી ૫ મિલી પ્રતિપંપ છાંટવી.</li> </ul> | <br><br><br><br> |

|                                                                                                                                                                                          |  |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             |
|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
|                                                                                                                                                                                          |  |    <ul style="list-style-type: none"> <li>કૃષ્ણમાખીનાનિયંત્રણમાટે સીટામીપ્રીડરોટકાઈપ ગ્રામદ્વારી પલીટરપાણીમાં ભેગવી છંટકાવ કરવો.</li> </ul>     <ul style="list-style-type: none"> <li>રીંગાળાના પાકમાં જો</li> </ul> <p>કૃષ્ણઅને ડોકાની ઈયળોનો ઉપદ્રવ હોય તો રીનાક્ષી પાયર ૧૮.૫ એસ. સીટવાપ મીલી ૧ પલીટરપાણીમાં મીશ્રકરી ને છંટકાવ કરવો.</p>    <ul style="list-style-type: none"> <li>શાકભાજ પાકોમાં પાનકથી રીનો ઉપદ્રવ જોવા મળે તો ફેના આકવિન ૧૦ ઈસી ૧૦ મિલી અથવા ડાયફેન્યુરોન ૫૦ ડબલ્યુ પી ૧૫ ગ્રામ ૧૫ લીટર પાણીમાં પંપમાં નાખીને છંટકાવ કરવો.</li> <li>ભીડામાં સફેદ માખી અને લીલી પોપટીના નિયંત્રણ માટે લીઓળીનું નેલ ૫૦ મી.લી. અથવા લીઓળીના મીજનું ૫ ટકા અંદું નુદ્રાવણ ૫૦૦ મી.લી. અને ડાયફેન્યુરોન ૫૦ ટકા વે.પા. ૧૬ ગ્રામ દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.</li> </ul> |
| <br><b>પશુ</b><br> |  | <ul style="list-style-type: none"> <li>પશુઓના રહેઠાણની જ જ્યાની વ્યવસ્થિત સફાઈ રાખવી અને માખીઓના ઉપદ્રવથી બચવા ફ્લિનાઈલ છાંટવું અથવા લીમડાનાં પાનનો ધુમાડો કરવો.</li> <li>પશુને ડથી ૮ કી.ગ્રા. સુકો અને ૧૫ થી ૨૦ કી.ગ્રા. લીલો ચારો આપવો. આપવી. દુધાળા પશુઓને પ્રતિ લીટર દુધની ઊપજ હોય તેમને નિયમિત ૧કી.ગ્રા. ફીડ + ૫૦ ગ્રામ ખની તત્ત્વોનું મિશ્રણ આપવું.</li> <li>ઈતરડીના નિયંત્રણ માટે ડેલ્ટામેથ્રીન અથવા એમીટ્રોલ ૨ મી.લી. એક લીટર પાણીમાં નાખીને છાંટવી.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |



## District Agrometeorological Unit (DAMU)

Gramin Krushi Mausam Seva (GKMS)

Krishi vigyan kendra

Junagadh Agricultural University

Jamnagar-361006

Date:07-11-2020 to 11-11-2020



**Jamnagar District Agromet Advisory Service bulletin No. 46(2020) Date: 06-11-2020**

(Issued jointly by Junagadh Agricultural University and India Meteorological Department)

### Significant weather for the preceding week

| weather parameter        |           |       |
|--------------------------|-----------|-------|
| Rain fall (mm)           | 0.0       |       |
| Maximum temperature (°C) | 33.0-34.0 |       |
| Minimum temperature (°C) | 16.5-19.0 |       |
| Relative Humidity (%)    | Morning   | 62-77 |
|                          | Afternoon | 24-33 |
| Wind speed (Kmph)        | 2.5-3.7   |       |

### Weather forecasting for Jamnagar District

(Period from Date: 07-11-2020 to 11-11-2020)

| Date                     | Day-1<br>07-11-20 | Day-2<br>08-11-20 | Day-3<br>09-11-20 | Day-4<br>10-11-20 | Day-5<br>11-11-2020 |
|--------------------------|-------------------|-------------------|-------------------|-------------------|---------------------|
| Parameter                |                   |                   |                   |                   |                     |
| Rain fall (mm)           | 0                 | 0                 | 0                 | 0                 | 0                   |
| Maximum temperature (°C) | 33                | 34                | 35                | 35                | 35                  |
| Minimum temperature (°C) | 23                | 23                | 23                | 23                | 23                  |
| Cloud cover (okta)       | Clear             | Clear             | Clear             | Clear             | Clear               |
| Relative Humidity-I (%)  | 35                | 47                | 56                | 43                | 35                  |
| Relative Humidity-II (%) | 22                | 21                | 26                | 28                | 21                  |
| Wind speed (Km/h)        | 11                | 12                | 14                | 15                | 13                  |
| Wind Direction (deg.)    | E                 | S                 | NW                | NE                | E                   |

Note: Above forecast is the average situation of whole district not for one particular place.

Gramin Krushi Kausham Seva, Krishi Vigyan Kendra, Jamnagar and Indian meteorological department announce upcoming five days weather forecast of Jamnagar district

**Rain fall:** Sky will be observed clear for next five days. In the next no chances of rainfall.

**Temperature:** Maximum and minimum temperature likely to be in range 34-35 °C and 23 °C, respectively.

**Relative Humidity:** The RH-I and RH-II is likely to be in the range of 35-56 % & 21-28, respectively.

**Wind Direction and Speed:** Direction and speed of wind is likely to be NE-S and 11-15 km/h, respectively.

| Crop wise Advise |                                 |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                      |
|------------------|---------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| <b>crop</b>      | <b>Pest/<br/>Disease/ Stage</b> | <b>Advisery</b>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                      |
| Wheat            | Sowing                          | <ul style="list-style-type: none"> <li>• Prepare the soil for wheat crop cultivation.</li> <li>• If drip irrigation facility available then cultivate wheat crop in drip irrigation.</li> <li>• Collect the wheat crop seed on the basis of requirement.</li> <li>• Select the variety on the basis of date of sowing like <ul style="list-style-type: none"> <li>• Early sowing: (before 10th November): GJW-463</li> <li>• Timely Sowing: (15 to 25 November): Lok-1, GW-366, 496</li> <li>• Late sowing: (26 November to 10 September): GW-173,11 and Lok-11.</li> </ul> </li> <li>• Apply the fertilizer doze like N-P-K: 120-60-00 kg/ha. For the half dose of N and P fertilizer as basal dose apply the 130 kg DAP and 80 kg Urea per hectare.</li> <li>• Seed rate: 100-125 kg/ha</li> </ul> |
| Chick pea        | Sowing                          | <ul style="list-style-type: none"> <li>• Prepare the soil for Chick pea crop cultivation.</li> <li>• Sowing can be carried out in October month of reified variety and irrigated variety sowing carried out in November month.</li> <li>• Select the high yielding variety like Gujarat chickpea-3 and Gujarat chickpea-5.</li> <li>• Apply the 85 kg DAP and 10 kg Urea per hectare as basal dose at time of sowing.</li> <li>• Seed rate: 60-75 kg/ha</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                   |
| Cumin            | Sowing                          | <ul style="list-style-type: none"> <li>• Prepare the soil for Chick pea crop cultivation.</li> <li>• Sowing can be carried out in November month when cold night starting.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                |

|           |                                                         |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                |
|-----------|---------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
|           |                                                         | <ul style="list-style-type: none"> <li>Select the high yielding variety like Gujarat Cumin-3 and Gujarat Cumin -4.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  |
| Coriander | Sowing                                                  | <ul style="list-style-type: none"> <li>Prepare the soil for Chick pea crop cultivation.</li> <li>Sowing can be carried out in November month when cold night starting.</li> <li>Select the recommended variety like Gujarat Coriander-1, Gujarat Coriander-2.</li> <li>Seed rate: 15-20 kg/ha</li> <li>Give the application of 65 kg SSP and 45 kg Urea per hectare as basal dose.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  |
| Garlic    | Sowing                                                  | <ul style="list-style-type: none"> <li>Prepare the soil for Chick pea crop cultivation.</li> <li>Sowing can be carried out in November month.</li> <li>Select the high yielding variety like Gujarat Garlic-3, Gujarat Garlic-4, Gujarat Junagadh Garlic-5.</li> <li>Seed rate: 600-700 kg (cloves)/ha</li> <li>Apply the fertilizer doze like N-P-K: 50-500-50 kg/ha. Apply 110 kg DAP, 65 kg Urea, 65 kg MOP and 250 kg castor cake/ha as basal dose at time of sowing.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                           |
| Onion     | Sowing                                                  | <ul style="list-style-type: none"> <li>Select the variety like Nashik-53, Bhima Supar, Bhima Red, Junagadh local, Onion - 11, Pusa Red for winter crop sowing.</li> <li>Seed rate: 7-8 kg/ha</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        |
| Cotton    | <p>Pink bollworm</p> <p>Thrips, Jassid, Aphid, Mite</p> | <ul style="list-style-type: none"> <li>Apply irrigation at 7-8 days interval.</li> </ul> <div style="display: flex; justify-content: space-around;">   </div> <ul style="list-style-type: none"> <li>Control of Pink bollworm spray the insecticide like indoxacard 14.5% SC 8 ml/pump or clorantraniliprole 20% SC 6 ml/pump or flubendiamide 39.35% SC 20-25 gram/pump or Spinosad 45% SC 6 ml/pump spray at flowering stage.</li> <li>For the control of Thrips and Jassid, spray 3 ml phosphamidon OR 15 ml dimethoate OR 15 ml methyl-O-demeton mix in 10 liter of water.</li> <li>Due to rising of temperature, Thrips and Mite infestation observe in</li> </ul> |

|                |                         |                                                                                                                                                                                                                                                                                                                                             |
|----------------|-------------------------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
|                |                         | <p>cotton crop so spray the insecticide like Propargite 57% EC 30 ml/pump or Abamectin 1.9% EC 15 ml/pump at clear sky condition.</p> <ul style="list-style-type: none"> <li>If there is observed cotton leaves yellow and red, then spray 19-19-19 (N.P.K) @ 100g and Micromix (Grade-4) @ 25g per pump in 2 to 3 replications.</li> </ul> |
| Groundnut      |                         | <ul style="list-style-type: none"> <li>At maturity stage harvest the early sowing or bunch type groundnut.</li> <li>Carried out sun drying and store groundnut pod at 8-10% moisture level.</li> </ul>                                                                                                                                      |
| Castor         | Wilt                    | <ul style="list-style-type: none"> <li>For the control of wilt in castor use the Carbendazim 50 WP 20 gram or Copper oxychloride 50 WP 60 gram per 15 liter water pump mix and drenching around the wilted plant.</li> </ul>                                                                                                                |
|                | Semi looper, Spodoptera | <ul style="list-style-type: none"> <li>For the control of semi looper and spodoptera spray dichlorovos 76 EC 10 ml or methyl o demeton 25 EC 15 ml mix in 15 liter water and spray alternate.</li> </ul>                                                                                                                                    |
| Red gram       | Starility mosaic        |  <ul style="list-style-type: none"> <li>Red mite infestation and spread Starility mosaic virus, for control them spray properzait 57% EC 30-40 ml/pump.</li> </ul>                                                                                      |
| Sorghum/ Maize | Shoot fly               |  <ul style="list-style-type: none"> <li>Continuously monitor the sorgum crop for shoot fly infestation, if infestation observe above ETL spray imidacloprid 17.8 SL 5 ml/10 litre of water.</li> </ul>                                                  |
| Vegetables     |                         | <ul style="list-style-type: none"> <li>Infected plants should be uprooted and buried in the soil.</li> <li>Keep vegetable crop weed free.</li> </ul>                                                                                                                                                                                        |



- For the control of leaf Webber in fruit leafy vegetable spray 15 ml methyl-O-demeton (25 EC) Or 10 ml diamethoate (30 EC) in 15 liter of water.
- For the control of thrips and white fly, spray acetamiprid 20 % SP@ 10.0 gm / 10 lit of water at 15 days interval.



- For the control of thrips in chilli, spray 30 ml profenophos in 15 litres of water. In case of heavy attack make spray of spinosad or spinetoram 7-8 ml per 15 liter of water.



- In tomato crops control of fruit borer, spray indoxacarb 25 EC 30 ml or spinosad 45 EC 5 ml per pump mix in water and spray.



- For the control of Fruit fly spray acetamiprid 20 % 15 gm per 15 liter water pump.



- In brinjal and tomato crops control of fruit borer, spray reenaxipayar @ 5 ml in 15 lit of water.



- If mite infestation observe in vegetable then spray fenazaquin 10 EC 10

|     |  |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
|-----|--|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
|     |  | <p>ml or diafenuron 50 WP 15 gm per 15 liter water pump and carried out alternate spray.</p> <ul style="list-style-type: none"> <li>For control of whitefly &amp; jassids in Okra, spray 500 ml of 5 % neem seed extract or 50 ml neem oil or acephate75 % SP@ 15 gm or imidacloprid 17.8 SL 3 ml/10 litre of water.</li> </ul>                                                                                                                                                   |
| Cow |  | <ul style="list-style-type: none"> <li>Spray phenyl in the animal shed to avoid flies and mosquitoes. Keep animal shed hygienic and clean to avoid flies and mosquitoes.</li> <li>Provide 6-8 kg good quality dry roughage with 15-20 kg green fodder to the animals. For milch animals, regularly follow schedule of 1 kg feed + 50 g mineral mixture per 2 liters of milk yield.</li> <li>Spray Deltamethrin or Amitraz 2 ml/litre of water for the control of tick.</li> </ul> |